

પ્રશ્નો? કોલ કરો (800) 232-1700

સાઇડકીક

તમારા મોબાઇલ તબીબી ચેતવણી સાથે પ્રારંભ કરો



તમારા ઉપકરણને ચાર્જ કરી રહ્યા છીએ

શરૂઆત પરણામો માટે, તમારી સાઇડકકિને દરરોજ રાત્રે ચાર્જ કરો.



એકવાર તમને તમારી સાઇડકકિ મળી જાય, પછી તેના ચાર્જિંગ ક્લેડને આઉટલેટમાં પ્લગ કરો. એસઓએસ મદદ બટનને આગળ તરફ રાખીને ક્લેડમાં સાઇડકકિ મૂકો. ખાતરી કરો કે ચાર્જિંગ શરૂ કરવા માટે તમારી સાઇડકકિને ચાર્જિંગ ક્લેડમાં નશ્ચિતિપણે ધકેલી દેવામાં આવી છે. યોગ્ય રીતે ચાર્જ કરતી વખતે, ક્લેડ પરની **લાલ** લાઇટ યાલુ થશે અને સાઇડકકિ "ચાર્જિંગ" ની જાહેરાત કરશે.

જ્યારે સાઇડકકિ સંપૂર્ણપણે ચાર્જ થઈ જશે, ત્યારે ક્લેડ પરની **લાલ** લાઇટ બંધ થઈ જશે.



ખાતરી કરો કે પારણાની પાછળનો વાયર નશ્ચિતિપણે સ્થાને છે.

પ્રશ્નો?

કોલ કરો (800) 232-1700



સાઇડકલ્કિને સ્નાનમાં પહેરી શકાય છે પરંતુ તેને પાણીમાં ડૂબવું જોઈએ નહીં.



ને બે વખત દબાવો.
સાયલન્ટ બટન ટઅવાજ ચેતવણીઓને નષ્ટકરયિ/સક્રયિ કરવા માટે

લાઇટો

તમારા ઉપકરણનું પરીક્ષણ કરો



સ્ટેટસ લાઇટ

બ્લકિંસ કરે છે **લીલી**
જ્યારે સાઇડકકિ યોગ્ય રીતે કામ કરી
રહી હોય ત્યારે લાઇટ.

સ્થાન લાઇટ

બ્લકિંસ કરે છે. **વાદળી**
જ્યારે સ્થાન સેવાઓ ઉપલબ્ધ
હોય ત્યારે લાઇટ.

પાવર લાઇટ

જ્યારે પાવર લાઇટ બ્લકિંસ કરશે
ત્યારે તમારી સાઇડકકિને ચાર્જ
કરવાની જરૂર છે. **લાલ.**



ટેસ્ટ બટન

તમારી સાઇડકકિની ચકાસણી
કરવા માટે, તમારી સાઇડકકિની
બાજુમાં ટેસ્ટ બટન દબાવો
અને પકડી રાખો. તમે અમારા
પરીક્ષા કેન્ટ્ર સાથે જોડાયેલા
હશો.



નોંધ

શ્રેષ્ઠ પરિણામો માટે, માસકિ
ધોરણે તમારી સાઇડકકિની
ચકાસણી કરો.

પ્રશ્નો?

કોલ કરો(800) 232-1700

કટોકટીના કસિસામાં

જો તમને સહાયની જરૂર હોય, તો જ્યાં સુધી તમને વાઇબ્રેશન ન લાગે અથવા સક્રિયકરણ ટોન ન સંભળાય ત્યાં સુધી હેલ્પ બટન દબાવો અને પકડી રાખો.



મહત્વપૂર્ણ

આકસ્મિક સક્રિયકરણને રદ કરો, જ્યારે પૂછવામાં આવે ત્યારે સહાય બટન દબાવો અને છોડો.



ફોલ ડટિક્શન (વૈકલ્પિક)

ફોલ ડટિક્શન સક્ષમ ઉપકરણો માટે, જો તમે મદદ બટન દબાવવામાં અસમર્થ હોવ અને ફોલ મળી આવે, તો ઉપકરણ કેર સ્પેશિયલિસ્ટને કટોકટીની ફોલ ચેતવણી મોકલે છે.

શ્રેષ્ઠ પરિણામો માટે, લાન્યાર્ડ પર અને તમારા બધા કપડાંની બહાર તમારું મદદ બટન પહેરો.

ફોલ ડટિક્શન ફોલ્સની 100% ઓળખ કરતું નથી.

જો સક્ષમ હોય, તો વપરાશકર્તાઓએ જ્યારે પણ મદદની જરૂર હોય ત્યારે હંમેશા તેમનું બટન દબાવવું જોઈએ.


પ્રશ્નો?

કોલ કરો (800) 232-1700

બંધ/ચાલુ કરી રહ્યા છે


તમારી સાઇડકકિ હંમેશા ચાલુ રાખવી જોઈએ.
જો તમારી સાઇડ કકિને બંધ દબાવો **અને ટેસ્ટ** અને
હેલ્પ બટનોને એકસાથે પકડી રાખો જ્યાં સુધી તમને
કંપન ન લાગે.

ઉપકરણ પરની બધી લાઇટ્સ એક મનિટિની અંદર બંધ
થવી જોઈએ.



પ્રશ્નો?

તમારી સાઇડકકિને પાછળ **ચાલુ** રવા માટે તમે ટેસ્ટ
અને હેલ્પ બટનોને એકસાથે દબાવી શકો છો, અથવા
ઉપકરણને ચાર્જિંગ ક્રેડલમાં મૂકી શકો છો.



કોલ કરો (800) 232-1700

**અમે અહીં મદદ કરવા માટે આવ્યા છીએ.
કોલ કરો(800) 232-1700
સહાય માટે.**

આ ઉપકરણ કામ કરવા માટે સેલ્યુલર ક્વરેજ પર આધારિત છે.
જ્યાં સેલ્યુલર ક્વરેજ મર્યાદિત છે, ત્યાં તમને ઉપકરણની ઘટતી
કૃષમતાઓનો સામનો કરવો પડી શકે છે.